



ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ

પરિપત્ર :-

વિષય: અંગદાન જાગૃતી અંતર્ગત પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવા બાબત.

શ્રીમાન,

ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ એ 'અંગદાન' અંગે સમાજમાં જાગૃતતા આવે તે હેતુથી કાર્યરત સંસ્થા છે. જાણીતા સમાજ સેવક શ્રી દિલીપભાઈ દેશમુખ દ્વારા પોતાની લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળતાપુર્વક પૂર્ણ થયા બાદ પોતાનું શેષ જીવન અંગદાન જાગૃતી માટે આપવું તેવા સંકલ્પના ભાગરૂપે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.

આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં બ્રેઈન ડેડ દર્દીઓના અંગનું દાન થાય અને જરૂરીયાતવાળા દર્દીઓને અંગ પ્રાપ્ત થઈ શકે તે માટેનો છે. આ કાર્ય થકી અંગની રાહ જોઈને એક આશા સાથે જીવી રહેલા અનેક દર્દીઓને નવું જીવન મળી શકશે.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, મીડીયા ક્લબ અને ઈન્સ્ટીટ્યુટ ઓફ ક્રિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રીના જન્મ દિવસ નિમિત્તે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો, અનુસ્નાતક કેન્દ્રો તથા અનુસ્નાતક ભવનોમાં અંગદાન જાગૃતિ માટેની પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવા જણાવવામાં આવે છે. તે મુજબ સદરહુ પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન અંગદાન જાગૃતિ માટેના સંકલ્પના ભાગરૂપે આપની કોલેજોમાં અચુક કરીને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલ સમાજઉપયોગી ઉમદા કાર્યને વેગ આપવા વિનંતી.

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદરહુ કાર્યક્રમ બાબતે માન. કુલપતિશ્રીને પાઠવવામાં આવેલ તા. ૦૮/૦૮/૨૦૨૧ના પત્રની નકલ આ સાથે સામેલ છે જેમાં અંગદાન અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે, જે આપશ્રીને જાણ સારૂ.

ઉપરોક્ત કાર્યક્રમના આયોજન કયાના ફોટોગ્રાફ્સ તેમજ પ્રતિજ્ઞામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નોડેલ ઓફીસરશ્રીને મોકલી આપવા નમ્ર વિનંતી.

(૧) ડૉ. પરાગ દેવાણી, આસીસ્ટન્ટ પ્રોફેસર, સમાજશાસ્ત્ર ભવન (nssbknmu@gmail.com)

કા. કુલસચિવ

બિડાણ : (૧) અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટનો તા. ૦૮/૦૮/૨૦૨૧નો પત્ર

(૨) અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટનો પ્રતિજ્ઞા પત્ર અને અંગદાન અંગેની માહિતી

બિકેએનએમયુ/૨જી/૩૮૬/૨૦૨૧

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

સરકારી પોલીટેકનીક કેમ્પસ,

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,

ખડીયા, જુનાગઢ.

તા. ૧૩/૦૮/૨૦૨૧

પ્રતિ,

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અનુસ્નાતક ભવનોમાં મેરીટ લીસ્ટમાં સામેલ તમામ વિદ્યાર્થીઓ તરફ...

નકલ સાદર રવાના :-

૧. માન. કુલપતિશ્રીના અંગત સચિવશ્રી

નકલ સાદરરવાના જાણ તથા યોગ્ય કાર્યવાહી અર્થે

૧. આઈ.ટી.સેલ(વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવા અર્થે)



અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ

Email- contact@angdaan.org

કર્ણાવતી, ગુજરાત

Mobile – 8200487222 / 9909290393

તા. ૦૯ / ૦૯ / ૨૦૨૧

પ્રતિ

મા. કુલપતિશ્રી,

વિષય:- અંગદાન જાગૃતિ અંતર્ગત પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવા બાબત...

માનનીય સાહેબશ્રી,

સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે "અંગદાન" એ અંગે સમાજમાં જાગૃતતા આવે તે હેતુથી કાર્યરત સંસ્થા છે. જાણીતા સમાજ સેવક શ્રી દિલીપભાઈ દેશમુખ દ્વારા પોતાની લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક પુર્ણ થયા બાદ પોતાનું શેષ જીવન અંગદાન જાગૃતિ માટે આપવું તેવા સંકલ્પના ભાગરૂપે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.

આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં બ્રેઈન ડેડ દર્દીઓના અંગનું દાન થાય અને જરૂરીયાત વાળા દર્દીને અંગ પ્રાપ્ત થાય તે માટેનો છે. આ કાર્ય થકી અંગની રાહ જોઈને એક આશા સાથે જીવન જીવી રહેલા અનેક દર્દીઓને નવું જીવન મળી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર તથા ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સના સંયુક્ત ઉપક્રમે અંગદાન જાગૃતિ માટે "One Million Pledge" કાર્યક્રમ અંતર્ગત ૧૦ લાખ લોકો પ્રતિજ્ઞા લે તેવા શુભ સંકલ્પ સાથે પ્રતિજ્ઞાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત જ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કોલેજના વિદ્યાર્થી તથા સ્ટાફમાં અંગદાન વિષયને લઈને જાગૃતતા વધે તેમજ તેઓ પણ આ શુભ કાર્ય માટે પ્રતિજ્ઞા લે તેઓ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આગામી ૧૭ સપ્ટેમ્બરના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની વિવિધ કોલેજોમાં અંગદાન માટેની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ યોજાનાર છે.

તો આ પ્રકારનો કાર્યક્રમ આપના હસ્તકની કોલેજમાં પણ યોજાય તે પ્રકારનું આયોજન કરવા માટે નમ્ર વિનંતી છે.

આભાર સહ

આપના વિશ્વાસુ

ડૉ. પ્રશાંત જોષી



અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ

Email- contact@angdaan.org

કર્ણાવતી, ગુજરાત

Mobile – 8200487222 / 9909290393

અંગદાન અંગેની માહિતી

આજે પણ સમાજના અનેક લોકોને અંગદાન અંગેની જાણકારી નથી ,સમાજમાં હજી પણ અંગદાન ની જાગૃતિ જોઈએ તેટલા પ્રમાણમાં નથી. જોકે જાગૃતિનું પ્રમાણ ધીમેધીમે વધી રહ્યું છે , જે એક સારી બાબત છે. ઘણાને પ્રશ્ન થતો હોય છે કે અંગદાન એટલે શું? અંગદાન પહેલાં બ્રેઇન ડેડ અંગેની માહિતી અતિ જરૂરી છે. જે દર્દીનું મગજ કામ કરતું અટકી ગયું હોય તે દર્દીની ફરીથી ભાનમાં આવવાની અને જાતે શ્વાસ લેવાની શક્યતા રહેતી નથી. તે માત્ર કૃત્રિમ શ્વાસ પર જીવિત રહે , એટલે કે વેન્ટિલેટર મશીનથી દર્દીની શ્વાસની પ્રક્રિયા ચાલતી હોય તેવા દર્દીને બ્રેઇન ડેડ કહેવામાં આવે છે. દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરતા પહેલાં ડૉક્ટરની એક પેનલ તેની તપાસ કરે છે. ત્યારબાદ દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરે છે. આવા દર્દી માત્ર એક જીવિત લાશ સમાન હોય છે. જો તેના નિકટનાં સગાંસંબંધી આ બ્રેઇન ડેડ દર્દીના અવયવો એટલે કે હાર્ટ , કિડની, લીવર, આંખો દાન આપવાની મહેચ્છા કરે તો તેને અંગદાન કહેવામાં આવે છે.

સામાન્ય રીતે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા દર્દી વધારે બ્રેઇન ડેડ થતાં હોય છે. ઉલ્લેખનીય છે કે આવા દર્દીના અવયવો ગંભીર બીમારીમાં હોય એવા દર્દીના ઉપયોગમાં આવે છે. એટલે કે હાર્ટ , લીવર, કિડની જેવી બીમારીના દર્દીને ઉપયોગી બને છે. જોકે આજે પણ અંગદાન કરવામાં લોકો ખચકાટ અનુભવે છે, અનેક લોકો હજી પણ બ્રેઇન ડેડને મૃત્યુ તરીકે સ્વીકારવા તૈયાર થતા નથી. જેના લીધે તે અંગદાન કરવાની ઘસીને ના પાડતા હોય છે. સમાજે અંગદાન અંગે જાગૃત થવું પડશે. બ્રેઇન ડેથ દર્દીના નિકટના સંબંધી તેના મૃત્યુ સ્વીકારવા તૈયાર થતા નથી તે સ્વાભાવિક છે પરંતુ નક્કર વાસ્તવિકતા એ છે કે ૯૯ ટકા બ્રેઇન ડેડ દર્દી જીવિત થઈ શકતા નથી. દર્દીના સંબંધીઓએ ઉદારતાથી વિચારીને બ્રેઇન ડેડ દર્દીના અંગદાન માં આપવા જોઈએ. દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવા માટે ડૉક્ટરની એક પેનલ કામ કરે છે.

અંગદાન ની ઇચ્છા ધરાવનાર વ્યક્તિએ પોતાના ઘરના સભ્યોને અગાઉથી જાણ કરવી જોઈએ. એનું કારણ એ છે કે જ્યારે પણ ભવિષ્યમાં વ્યક્તિનું બ્રેઇન ડેડ થાય તો તેના અવયવો સરળતાથી મળી શકે , જેનાથી અન્ય દર્દીને લાભ થાય. વ્યક્તિએ પોતાના સૌથી નજીકના કુટુંબીજનને એક અગત્યના ફોર્મ દસ્તાવેજ પર સહી કરવાની હોય છે. જેથી કોઈ સંજોગોમાં અકસ્માતે મગજને ઇજા પહોંચે અને તમે બ્રેઇન ડેડ થાવ તો તમારા સંકલ્પ પ્રમાણે અંગદાન માં લઈ શકાય.

શરીરના અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. તેમાં કોઈ પણ ઉંમર , ધર્મ કે જાતિ હોય તેની સાથે કોઈ નિસબત નથી. કોઈ ભેદભાવ નથી. કોઈ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. બ્રેઇન ડેડ થયેલ દર્દીએ અંગદાન કર્યું હોય તો ટ્રાન્સપ્લાન્ટની ટીમ બ્રેઇન ડેડ દર્દીનું તબીબી પરીક્ષણ કરીને અવયવોનું દાન કરવા યોગ્ય છે કે નહીં તે તપાસીને તેની ચકાસણી કરે છે. શરીરમાંથી અવયવ બહાર કાઢીને તેનું પ્રત્યારોપણ



અંગદાન યેરીટેબલ ટ્રસ્ટ

Email- contact@angdaan.org

કર્ણાવતી, ગુજરાત

Mobile – 8200487222 / 9909290393

કરવું એ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે. તેમાં શરીરનું બિનજરૂરી ડિસેક્શન કરવામાં આવતું નથી. તેના લીધે અંતિમવિધિમાં કોઈ પણ પ્રકારની અડચણ થતી નથી.

તાજેતરમાં જ ભાવનગરના સિહોર તાલુકાના ચોરવડલા ગામના ૩૭ વર્ષીય આસીફ મહંમદભાઈ જુણેજાના અવયવો તેમના પરિવારે દાન કર્યા હતા. આસીફના પિતા મહંમદભાઈએ પોતાના સંતાનના અંગદાન માં આપવાની ઇચ્છા દર્શાવી , જે અંતર્ગત અમદાવાદની તબીબની ટીમ ભાવનગર પહોંચી હાર્ટ કિડની અને લીવર લેવામાં આવ્યાં. આસીફમાંથી લેવામાં આવેલા હાર્ટને ગ્રીન કોરિડોર રચીને અમદાવાદ લાવવામાં આવ્યું હતું. આ હાર્ટનું પ્રત્યારોપણ એક હિન્દુ દર્દીમાં કરવામાં આવ્યું જે સફળ નીવડ્યું. આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતની આ પ્રકારની પ્રથમ સર્જરી હતી જે ઇતિહાસના સોનેરી અક્ષરોમાં કંડારાઈ ગઈ. એક મુસ્લિમનું હાર્ટ હિન્દુમાં ધબકવા લાગ્યું.

અંગદાન કરવામાં કોઈ ધર્મ કે નાતજાત હોતી નથી. તેના અવયવોથી ત્રણ લોકોને જીવનદાન મળ્યું હતું. આ વિશે વાત કરતા આસીફના ભાઈ ઇમરાન જુનેજા કહે છે કે , "મારો ભાઈ બ્રેઇન ડેડ થતા અમે પરિવારજનોએ સાથે મળીને નિર્ણય લીધો. આમ તો આપણે કોઈને પાંચ રૂપિયાની પણ મદદ કરવા જતા નથી. જો આ રીતે સેવાનું કામ થઈ શકે તો તેમાં મારા ભાઈના આત્માને પણ શાંતિ મળે. જેથી અમે અવયવો દાન કરવાનું વિચાર્યું. પીપળિયા ગામના જયરામભાઈ ચાવડાનો અકસ્માત થતા બ્રેઇન ડેડ થયું. તેમનાં સંતાનોએ પિતાનાં અંગ દાન કરવાનો નિર્ણય લીધો. તેમની બે કિડની , સ્વાદુપિંડ અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે વાત કરતા તેમના પુત્ર ભરતભાઈ ચાવડા કહે છે કે , "પિતાજી ખૂબ જ સેવાભાવી હતા. તે હયાત હતા ત્યારે પણ બધાને મદદ કરતા ત્યારે તેમનું મૃત્યુ થવાથી તેમના અંગથી કોઈને જીવતદાન મળી શકે તો તેમના આત્માને આનંદ જ મળે. તેમનાં અંગનું દાન કરી અમે તેમના આત્માને શાંતિ અર્પી છે ને સાથે જ એક સેવાનું કાર્ય પણ કર્યું છે.

"પત્ની ભાવના પટેલનાં અંગ દાન કરનાર જયેશભાઈ પટેલ કહે છે કે , "ભાવના મારી જીવનસંગિની હતી. તેનું બ્રેઇન ડેડ થતા મને ઘણો આઘાત લાગ્યો હતો , પરંતુ તે ફરી તો પહેલાં જેવી થવાની જ નહોતી. માટે મેં મન મક્કમ કરીને તેના અંગદાનનો નિર્ણય કર્યો. આ મારા તરફથી તેને પ્રેમાળ શ્રદ્ધાંજલી હતી." અમદાવાદની સિવિલ હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ ડૉ.એચ.એલ.ત્રિવેદીના માર્ગદર્શન અને સમજાવટથી બ્રેઇન ડેડ થયેલા દર્દીના પરિવારજનો અંગદાન કરવા તૈયાર થઈ જાય છે.

સિવિલ હોસ્પિટલમાં ૨૦૧૪માં ૩૯, ૨૦૧૫માં ૭૧ અને ૨૦૧૬માં ૧૦૩ વ્યક્તિએ અવયવોનું દાન કર્યું છે. જે સમાજમાં આ બાબતે જાગૃતિ વધી રહી હોવાનું પ્રમાણ છે. આ વિશે વાત કરતા સિવિલ કિડની હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર વિરેન ત્રિવેદી કહે છે કે , "હવે ધીમેધીમે અવયવો દાન કરવાની જાગૃતિ લોકોમાં વધી રહી છે. જોકે હજુ પણ આપણે ત્યાં અંગદાનને સ્વીકારવા લોકો તૈયાર નથી થતા. આ વિશે ઉદારતાથી વિચારવું અનિવાર્ય છે.



અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ

Email- contact@angdaan.org

કર્ણાવતી, ગુજરાત

Mobile – 8200487222 / 9909290393

અંગદાન કરવામાં સૌથી વધારે સુરત અને ભાવનગર મોખરે છે. અહીંના લોકામાં અવેરનેસ ખૂબ જોવા મળે છે. જોઇએ." સિવિલ હોસ્પિટલ દ્વારા ૨૫ નવેમ્બરે અંગદાન આપનાર દર્દીના ૪૮ કુટુંબીજનોનું સન્માન કરાયું હતું. સમાજમાં બ્રેઇન ડેડ અંગેની જાગૃતિ ધીમે ધીમે વધી રહી છે તે ખુશીની વાત છે. છતાં હજુ વધુ જાગૃતિ અને ખાસ કરીને આ વિષયે પ્રવર્તતી ગેરસમજને દુર કરવા એનજીઓ , સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોએ અંગદાન માટે સેમિનાર ગોઠવી અને જાહેરાત કરીને સમાજમાં અવેરનેસ લાવવા કટિબદ્ધતા દાખવવી જોઇએ જેનાથી સમાજને ફાયદો થાય.

સ્ત્રોત: સમભાવ ન્યુઝ

ભારતમાં અંગદાન

પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં અંગદાનની બાબતમાં ભારે ઉદાસીનતા પ્રવર્તે છે , જેને માટે મોટે ભાગે ધાર્મિક માન્યતાઓ કારણરૂપ છે. વાસ્તવિકતા એ છે કે અંગદાન એ પુણ્યનું કામ છે. એક વ્યક્તિનાં વિવિધ અંગોનાં દાનથી કમ સે કમ સાત જણની જિંદગી બચાવી શકાય છે. જેમાં હૃદય , કિડની (2), લીવર, ફેફસાં, પેક્રિયાસ (સ્વાદુપિંડ) અને નાના આંતરડાનો સમાવેશ થાય છે. બ્રેઇન ડેડ થયેલી વ્યક્તિનું આ પ્રકારે અંગદાન કરી શકાય છે.

અંગદાન વિવિધ પ્રકારના છે જેમાં લાઈવ રિલેટેડ ડોનેશન , લાઈવ એનરિલેટેડ ડોનેશન તેમજ ડીસીઝડ/ કેડેવર ઓર્ગન ડોનેશનનો સમાવેશ થાય છે. વ્યક્તિ બ્રેન ડેડ થાય અને તેનું સર્ક્યુલેશન કૃત્રિમ રીતે કરાઈ રહ્યું હોય ત્યારે શક્ય તેટલી જલદી તેનાં અંગો શરીરમાંથી કાઢી લેવાં જરૂરી છે , જ્યારે ટિસ્યુઝ 12 થી 24 કલાકની અંદર કાઢી શકાય છે.

ભારતમાં લગભગ દોઢ લાખ લોકોને કિડનીની જરૂર છે , પરંતુ તેમાંના ફક્ત 3000નેજ તે મળે છે. 90 ટકા લોકો કિડની મેળવ્યા વિના પ્રતીક્ષા યાદી પર હોય ત્યારેજ મૃત્યુ પામે છે તેવીજ રીતે ભારતની વાર્ષિક લીવર પ્રત્યારોપણની જરૂરિયાત 25,000 છે, પણ આપણે કેવળ 800 લીવરજ મેળવી શકીએ છીએ. મૃત્યુ બાદ દરેક જણ સંભવિત અંગદાન કરનારા બની શકે છે.

જોકે, કેન્સર, એચઆઈવી, સેપ્સીસ (ચામડી પર ગડગુમડનો સડો) જેવી બાબતોમાં અંગદાન કરી શકાતું નથી. હિપેટાઈટિસ `સી'ના દર્દીઓ તેવાજ રોગના દર્દીને તેવીજ રીતે હિપેટાઈટિસ `સી'ના દર્દીઓ પણ તેવા રોગના દર્દીને પોતાનાં અંગોનું દાન કરી શકે છે. જોકે, જવલ્લેજ કેસોમાં આવું બનતું હોય છે.

દરેક વયસ્ક વ્યક્તિ `ઓર્ગન ડોનર' બની શકે છે તેમજ મા-બાપની સંમતિથી બાળકનાં અંગોનું પણ દાન કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ 100 વર્ષની વય સુધી - આંખ અને ત્વચા , 70 વર્ષ સુધી - કિડની , લીવર, 50 વર્ષ સુધી - હૃદય, ફેફસાં અને 40 વર્ષની વય સુધી - હૃદયના વાલ્વનું દાન કરી શકે છે.



અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ

Email- contact@angdaan.org

કર્ણાવતી, ગુજરાત

Mobile – 8200487222 / 9909290393

આવાં કોઈ પણ અંગ મેળવનારા દર્દી માટે પ્રત્યારોપણનો અર્થ 'નવી' જિંદગી થાય છે. જેમના હૃદય, લીવર અને કિડની જેવા અત્યાવશ્યક અંગો કામ ન કરતાં અથવા બગડી ગયાં હોય તેઓ આ અંગોનું પ્રત્યારોપણ કરાવી શકે છે અને તેનાથી સામાન્ય જીવન ગુજારી શકે છે.

ઘણા લોકો એવું માનતા હોય છે કે ટ્રાન્સપ્લાન્ટેશન અોફ હ્યુમન ઓર્ગાન્સ એક્ટ હેઠળ માનવ અંગોનું વેચાણ કે ખરીદી થઈ શકે છે , પરંતુ આ સદંતર ખોટું અને ગેરકાયદે છે અને તેનું ઉલ્લંઘન કરનારાને દંડ તેમજ જેલની સજાની કાયદામાં જોગવાઈ છે.

પશ્ચિમી દેશોથી વિપરીત ભારતમાં અંગદાન કરવાનું પરિવારજનોની પસંદગી પર નિર્ભર છે. ડોનર કાર્ડ ધરાવતી વ્યક્તિ મૃત્યુ પામ્યા બાદ પણ પરિવારે અંગદાન માટેની મંજૂરી આપવી ફરજિયાત છે. અહીં એક અગત્યની વાત એ છે કે અંગદાનને લગતો કોઈ પણ ખર્ચ અંગદાન કરનારી વ્યક્તિના પરિવાર પાસેથી લેવામાં આવતો નથી. વ્યક્તિ પોતાની હયાતી દરમિયાન રક્ત , બોન મેરો, કિડની તેમજ લીવર , પેક્રિયાસ અને ફેફસાંના અમુક હિસ્સાનું દાન કરી શકે છે , જ્યારે મૃત્યુ બાદ આંખો , હાર્ટ વાલ્વ, ત્વચા, અસ્થિ, સ્નાયુ ઇત્યાદિનું દાન કરી શકાય છે. યાદ રાખો કે ડોક્ટર કોઈ પણ વ્યક્તિને તે 'બ્રેઈન ડેડ' થઈ ગઈ છે એવું જાહેર કરે ત્યાર બાદજ તેનાં વિવિધ અંગોનું દાન કરી શકાય છે.

ફક્ત કિડની મેળવવા માટેની પ્રતીક્ષા યાદી જ એક લાખથી વધુની છે

સ્ત્રોત: જન્મભૂમિ



અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ

Email- contact@angdaan.org

કર્ણાવતી, ગુજરાત

Mobile – 8200487222 / 9909290393

અંગદાન માટેની પ્રતિજ્ઞા

આથી હું પ્રતિજ્ઞા લઉં છું કે, જો હું આકસ્મિક રીતે બ્રેઈનડેડ જાહેર થાવ તો અન્યને જીવતદાન આપવા માટે મારા અંગોનું દાન કરવા મારી સંમતિ આપુ છું.

આ ભગિરથ કાર્યમાં મારા સંકલ્પને પૂર્ણ કરવા માટે મારા પરીવારજનોનો પણ સહકાર મળશે.

આ સિવાય મારા પરીવારમાં / મારા મિત્રવર્તુળમાં / માર સમાજમાં કે, મારી આસપાસ કોઈ પણ વ્યક્તિ આકસ્મિક બ્રેઈનડેડ જાહેર થશે, તો તેમના અંગોનું દાન કરવા માટે તેમના પરીવારજનોને હું સમજાવીશ અને પ્રેરીત કરીશ.

અંગદાન એ જીવનદાન.....

નોંધ:— આ કાર્યક્રમના ફોટા તથા માહિતી આપ સ્થાનીક સમાચાર પત્ર/ન્યુઝ ચેનલ તથા સોસિયલ મિડીયાના માધ્યમથી પ્રચાર પ્રસાર થાય તે માટેના પ્રયત્ન કરશો.